

# Official Visit of Minister of State for External Affairs Smt. Meenakshi Lekhi to Serbia (October 10-13, 2021)

October 09, 2021

## રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીની સર્બિયાની સત્તાવાર મુલાકાત (ઓક્ટોબર 10-13, 2021)

ઓક્ટોબર 09, 2021

વિદેશ અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી, શ્રીમતી મીનાક્ષી લેખી (એમએલ) 10-13 ઓક્ટોબર 2021 દરમિયાન બેલગ્રેડ, સર્બિયાની મુલાકાત લેશે. તેઓ બિન-જોડાણવાદી ચળવળની 60મી વર્ષગાંઠ નિમિત્તે ઉચ્ચ સ્તરીય સ્મારક બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાનના વિશેષ દૂત તરીકે જઈ રહ્યા છે.

2. 60મી વર્ષગાંઠ એનએએમ સ્મારક સભા સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વ્યુસિસ અને એનએએમના અધ્યક્ષ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવ દ્વારા સંયુક્ત રીતે સંબોધવામાં આવશે.

3. 1961માં બેલગ્રેડમાં યોજાયેલી પ્રથમ એનએએમ પરિષદની 60મી વર્ષગાંઠ, પરસ્પર સન્માન, એકતા અને સહકારના સ્થાપક સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન આપીને આંદોલન જટિલ વૈશ્વિક પડકારોને વધુ અસરકારક રીતે કેવી રીતે પ્રતિસાદ આપી શકે છે તેના પર વિચાર કરવાની તક પૂરી પાડે છે. એનએએમના સ્થાપક સભ્ય તરીકે ભારત વિકાસશીલ વિશ્વની સમસ્યાઓ રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે એનએએમને મજબૂત કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.

4. 60મી વર્ષગાંઠ એનએએમ સ્મારક બેઠક દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી (એમએલ) બેલગ્રેડમાં યુએન ડાઉસમાં 76મી યુએનજીએના પ્રમુખ દ્વારા યોજવામાં આવતા પ્રતિનિધિમંડળના મહિલા વડાઓ અને વિદેશ બાબતોના મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લે તેવી શક્યતા છે.

5. આ મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી (એમએલ) નાયબ વડાપ્રધાન અને કૃષિ, વનીકરણ અને જળ વ્યવસ્થાપન મંત્રી મહામહિમ બ્રેનિસ્લાવ નેડિમોવિક, નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી ડો. નેબોજા સ્ટેફાનોવિક, નાયબ પ્રધાનમંત્રી અને સંસ્કૃતિ અને માહિતી મંત્રી માજા ગોઝકોવિક, તથા વેપાર, પ્રવાસન અને ટેલિકોમ્યુનિકેશન મંત્રી તાન્જના માટિસ સાથે મંત્રણા કરશે.

6. ભારત અને સર્બિયા ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવા મુલાકાત દરમિયાન દ્વિવપક્ષીય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ (સીઈપી) પર હસ્તાક્ષર કરવામાં આવશે. રાજ્યકક્ષાના મંત્રી (એમએલ) બેલગ્રેડ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં 'ભારતમાં ન્યાયતંત્રનું માળખું' પર પ્રવચન આપશે. તેઓ બેલગ્રેડમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું ઔપચારિક અનાવરણ કરશે. આ ઉપરાંત તેઓ ભારતીય

સમુદાયના સભ્યો અને ભારતના મિત્રો સાથે વાતચીત કરશે અને સૌથી જૂના સર્બિયન સાહિત્યિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સમાજ મેટિકા શ્રીપસ્કાની પણ મુલાકાત લેશે અને ભારતમાં સંસ્થાઓ સાથે વધુ સહકારની રીતો અંગે ચર્ચા કરશે.

7. રાજ્યકક્ષાના મંત્રીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

નવી દિલ્હી

ઓક્ટોબર 09, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.